



પરિપત્ર :-

વિષય: પરીક્ષા અંતર્ગત કોપીકેસની કાર્યવાહી માટેના સુચના

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો આચાર્યશ્રીઓને ઉપર્યુક્ત વિષય અન્વયે જણાવવામાં આવે છે કે અત્રેની યુનિવર્સિટી દ્વારા લેવાનાર સીબીએસસી/નોનસીબીએસસી તમામ પરીક્ષા દરમ્યાન ગેરરિતી/ગેરવર્ણક અંતર્ગત કોપીકેસની કાર્યવાહી માટે નીચે મુજબના સુચનો ધ્યાને લઈ અમલવારી કરવા જણાવવામાં આવે છે.

- યુનિવર્સિટી અથવા યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની કામગીરી માટે અધિકૃત કરેલ હોય તેવી કોઈ પણ અધિકારી/વ્યક્તિ તરફથી આપવામાં આવેલ સુચનાનો અમલ ન કરે, તાકીદ આપ્યા છતાં પરીક્ષા ખંડમાં વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને મૌખિક કે કોઈ સંકેત દ્વારા સંદેશો પાઠવતો હોય તો, તેમજ પરીક્ષાર્થી પરીક્ષા દરમ્યાન કોઈ પણ બહારનું /કારણ આપીને વારંવાર પરીક્ષાખંડની બહાર જાય ત્યારે મુખ્ય કે ખંડ નિરીક્ષક આ રીતે વારંવાર બહાર ન જવાની સુચના આપે તેમ છતાં પણ સુચનાનો અનાદર કરે તેવા કિસ્સામાં યુનિવર્સિટી અધિકૃત અધિકારી/પરીક્ષા કેન્દ્ર સંચાલક/કોલેજના આચાર્યશ્રી/જુનિયર સુપરવાઇઝર/સીનીયર સુપરવાઇઝર દ્વારા ગેરરિતી અંગેની કાર્યવાહી કરી શકશે.
- યુનિવર્સિટી ખાતે કોપીકેસ કાર્યવાહી અંતર્ગત સુનાવણી સમયે અનુભવે ધ્યાનમાં આવેલ છે કે, કેટલાક પરીક્ષા કેન્દ્ર દ્વારા ગેરરિતી/ગેરવર્ણક કાર્યવાહી અંતર્ગત વિદ્યાર્થીઓ પાસેથી મળેલ સાહિત્ય યોગ્ય રીતે જોડવામાં આવતું નથી જે ગંભીર બાબત હોય, પરીક્ષા દરમિયાન જે વિદ્યાર્થી પાસેથી વિષય સંબંધિત સાહિત્ય મળી આવે તે તમામ સાહિત્ય પર વિદ્યાર્થીની, જુનિયર સુપરવાઇઝર અને સીનીયર સુપરવાઇઝરશ્રી/ઓબ્ઝર્વરશ્રીની સહી કરી તમામ સાહિત્ય સાથે ઉતરવહી યુનિવર્સિટી ખાતે મોકલી આપવાની રહેશે.
- પરીક્ષા કેન્દ્ર ખાતે થયેલ કોપી કેસો કોલેજના રવાનગી પત્ર સાથે યુનિવર્સિટી દ્વારા નિયત કરેલ નમુનામાં વિદ્યાર્થીની સહી, જુનિયર સુપરવાઇઝરની સહી અને નામ, સીનીયર સુપરવાઇઝરની સહી અને નામ તેમજ ઓબ્ઝર્વરની સહી સાથે તેમજ વિદ્યાર્થીની હોલટીકીટની ઝેરોક્ષ નકલ કોપી કેસના નિયત નમુના ફોર્મમાં કોલેજના આચાર્યશ્રીના સહી/સિક્કા તથા યુનિવર્સિટી દ્વારા જ્યારે કોપીકેસના બનાવનું વિડિયો રેકોર્ડિંગ મંગાવવામાં આવે ત્યારે સીડી સાથે માહિતી મોકલી આપવાની રહેશે.
- યુનિવર્સિટી ખાતે કોપીકેસ કાર્યવાહી અંતર્ગત સુનાવણી સમયે અનુભવે ધ્યાનમાં આવેલ છે કે, યુનિવર્સિટીના સીસીટીવી મોનીટરીંગ વિભાગ દ્વારા ગેરરિતી/ગેરવર્ણક સંબંધે જ્યારે સુચના આપવામાં આવે છે ત્યારે પરીક્ષા કેન્દ્ર દ્વારા કોપીકેસ રીપોર્ટમાં માત્ર “સીસીટીવી મોનીટરીંગ દ્વારા મળેલ સુચનાથી” શબ્દનો ઉલ્લેખ કરે છે પરંતુ વિદ્યાર્થી પાસેથી મળેલ સાહિત્યનો ઉલ્લેખ કરેલ હોતો નથી, યુનિવર્સિટીના સીસીટીવી વિભાગ દ્વારા આપવામાં આવેલ સુચનાથી સીસીટીવી કેમેરા ધ્યાને લઈ કોપી કેસ થયેલો હોય તો તે કિસ્સામાં પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી પાસેથી મળેલ જરૂરી સાહિત્યનો ઉલ્લેખ સ્પષ્ટતા સાથે વિદ્યાર્થીની સહી, જુ. સુપરવાઇઝરશ્રીની સહી, સીનીયર સુપરવાઇઝરશ્રીની સહી તેમજ વિદ્યાર્થી પાસેથી મળી આવેલ સાહિત્ય ઉપર વિદ્યાર્થીની સહી તેમજ સીનીયર સુપરવાઇઝરશ્રીએ સહી-સિક્કા તેમજ તારીખ અચુક લખવાની રહેશે.
- જુનિયર સુપરવાઇઝર/સીનીયર સુપરવાઇઝરશ્રી/ઓબ્ઝર્વરશ્રીએ કરેલા કોપી કેસ રીપોર્ટ યુનિવર્સિટીને મોકલતી વખતે આ રીપોર્ટમાં જરૂરી વિગતો અને પકડાયેલ સાહિત્યમાં સહી-સિક્કા અને તારીખ સાથેની વિગતો ભરેલ છે કે કેમ? તે ચકાસવાની જવાબદારી સીનીયર સુપરવાઇઝરશ્રીની રહેશે. કોપી કેસના રીપોર્ટમાં





ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ

(ગુજરાત અધિનિયમ નં. ૨૩/૨૦૧૫ દ્વારા સ્થાપિત)

BHAKTA KAVI NARSINH MEHTA UNIVERSITY, JUNAGADH

[Established vide Government of Gujarat Act No. 23/2015]

75
આજ્ઞાદીકા
અમૃત મહોત્સવ

અધુરી વિગતવાળા તથા વિદ્યાર્થીના પુરા નામ સરનામા, પીનકોડ વગરના કોપી કેસ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં.

- પરીક્ષા ગેરરીતિ કેસોના રીપોર્ટ તૈયાર કરવાની જવાબદારી જે-તે કોલેજના આચાર્યશ્રી/સીનીયર સુપરવાઇઝરની રહેશે. રીપોર્ટમાં તમામ વિગતો ફરજિયાત ભરવાની રહેશે, રીપોર્ટ ફોર્મ વ્યવસ્થિત ભરાય જાય ત્યાં સુધી વિદ્યાર્થીને ઉપસ્થિત રાખી નિવેદનો લેવાની જવાબદારી પરીક્ષા કેન્દ્રના આચાર્યશ્રી/સીનીયર સુપરવાઇઝરની રહેશે.
- પરિક્ષા ખંડમાં વિદ્યાર્થી શરીરના ઉપર કે તેમના કપડા ઉપર લખાણ કરેલ હોય તો તેનો પુરાવો ફોટોગ્રાફ લઈ અને સીનીયર સુપરવાઇઝરશ્રીની સહીની અને રીપોર્ટ સાથે યુનિવર્સિટીને મોકલવાનો રહેશે. પરીક્ષા ખંડમાં મોબાઇલ સાથે પકડાયેલ હોય તો મોબાઇલની વિગતો અને તેનો ફોટોગ્રાફ સાથેનો રીપોર્ટ મોકલવાનો રહેશે.
- કોપીકેસ/ગેરરીતિ/ગેરવર્તણૂકના કેસો યુનિવર્સિટીના લીગલ વિભાગને દિન રમાં યુનિવર્સિટીના કામકાજના દિવસો દરમ્યાન મોકલી આપવાના રહેશે.
- કોપી કેસ રીપોર્ટની બીજી નકલ અલગથી પરીક્ષા નિયામકશ્રીને ફરજિયાત મોકલવાની રહેશે.
- જે પરીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને ગેરરીતિ/ગેરવર્તણૂકમાં મદદગારી કરશે અને યુનિવર્સિટીને ધ્યાને આવશે તેવી ગંભીર બાબત પરત્વે યુનિવર્સિટી દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
- પરીક્ષા દરમ્યાન પરીક્ષાર્થીના ગેરવર્તણૂકને કારણે પોલીસ કેસ થયેલ હોય અને નામદાર કોર્ટ જે સજા ફરમાવે તે સજા સંબંધિત વિદ્યાર્થીને બંધનકર્તા રહેશે.
- ઉત્તરવહી કે પુરવણી પરીક્ષા કેન્દ્રની બહાર વિદ્યાર્થી કે અન્ય પાસેથી લખેલી કે કોરી પકડાય તેવાં કિસ્સામાં જે પરીક્ષા કેન્દ્રમાંથી ઉત્તરવહી/પુરવણી નોંધાયેલ હશે તે પરીક્ષા કેન્દ્ર/કોલેજ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
- પરીક્ષા કેન્દ્રમાં આચાર્યશ્રી/પરીક્ષા કેન્દ્ર સંચાલકશ્રી, યુનિવર્સિટી અધિકૃત તેમજ પરીક્ષામાં રોકાયેલ સ્ટાફ સિવાયના વ્યક્તિઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવો નહીં.
- જે વિદ્યાર્થી કોપીકેસની કાર્યવાહી કરવામાં આવેલ હોય તે વિદ્યાર્થી પછીના તમામ પેપરમાં ઉપસ્થિત રહી શકશે નહીં.

ડી. ડી. નિયામક
પરીક્ષા નિયામક

ક્રમાંક: ક્રમાંક/બીકેએનકએમયુ/લીગલ/૧૧૮/૨૦૨૨
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,
સરકારી પોલીટેકનીક કેમ્પસ,
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ, ખડીયા, જુનાગઢ.
તા.૦૭/૦૪/૨૦૨૨

પ્રતિ,

- પરીક્ષા કેન્દ્ર સંચાલકશ્રી, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ.

નકલ રવાના :-

૧) માનનીય કુલપતિશ્રી/કુલસચિવશ્રીના રહસ્ય સચિવશ્રી તરફ...

સરકારી પોલીટેકનીક કેમ્પસ,
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ,
ખડીયા, જુનાગઢ-૩૬૨ ૨૬૩, ગુજરાત(ભારત)
ફોન નં.૦૨૮૫-૨૬૮૧૪૦૦ / ફેક્સ નં.૦૨૮૫-૨૬૮૧૫૦૩



www.bknmu.edu.in ||



exambknmu@gmail.com

Government Polytechnic Campus,
Bhakta Kavi Narsinh Mehta University Road,
Khadiya, Junagadh-362263 (Gujarat)
Ph: 0285-2681400 Fax: 0285-2681503